

VISHWANIDAM

સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2016 દરમિયાન
વિશ્વનિડમ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓનો અહેવાલ

- 5 સપ્ટેમ્બર 2016નાં રોજ “શિક્ષક દિન” નિમિત્તે વિશ્વનિડમ સંચાલિત કલરવ સંસ્કાર કેન્દ્રમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વિશ્વનિડમ સંચાલિત તમામ કલરવ કેન્દ્રોમાં બાળકો શિક્ષક બનીને આ દિવસને ખાસ બનાવ્યો.



- 8 અને 9 સપ્ટેમ્બર 2016ના રોજ બાળકો દ્વારા બનાવવામાં આવેલ માટીનાં દીવડાઓ અને ગીફ્ટેડ વસ્તુઓનું વેચાણ માટેનું પ્રદર્શન રાજકોટની પ્રખ્યાત એવી ઠાકર હોટેલમાં રાખવામાં આવ્યું.



- 21,22,23 અને 24 સપ્ટેમ્બર 2016નાં રોજ રાજકોટની ધોળકિયા સ્કુલમાં વિશ્વનીડમના બાળકો દ્વારા બનાવવામાં આવેલ દીવડાઓ અને ગીફ્ટેડ વસ્તુઓનું વેચાણ માટેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું.
- 29 સપ્ટેમ્બર 2016નાં રોજ વિશ્વનીડમ કલરવ સંસ્કાર કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોના જ્ઞાનમાં વધારો થાય તેવા હેતુથી “જનરલ નોલેજ પ્રશ્નોત્તરી”ની પરિક્ષા યોજવામાં આવી જેમાં વિશ્વનીડમના ૨૦૦ થી વધારે બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.



- 2 ઓક્ટોબર 2016નાં રોજ ઇન્કમટેક્સ ઓફિસર મિત્રો ‘ગાંધી સપ્તાહ’ ઉજવણી અંતર્ગત વિશ્વનીડમના બાળકોને મળવા હેપ્પીહોમ (મોટા મવા) આવ્યા હતા.
- 10 ઓક્ટોબર 2016ના રોજ સ્વીડન વાસીઓ હેપ્પીહોમની મુલાકાતે આવેલ અને બાળકો સાથે સમય પસાર કર્યો.
- 27 ઓક્ટોબર 2016નાં રોજ વિશ્વનીડમ દ્વારા આયોજિત માટીની મહેક એવોર્ડ ડિસ્કશનમાં રાજકોટનું ગૌરવ એવા બે બાળકો (જય છાનીયારા અને ઉતમ માડું)નું વિશ્વનીડમનાં કાર્યકર્તાઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું, અને તેઓની કુદરતી કલાઓને માણી.



- 27 ઓક્ટોબર 2016નાં રોજ 'ચીથરે વીટેલ ચિરાગ' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.



- 27 ઓક્ટોબર 2016નાં રોજ વિશ્વનીડમના કોલેજ સુધી પહોચેલા વિદ્યાર્થીઓને 'બાળ પ્રતિભા' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
- 27 ઓક્ટોબર 2016નાં રોજ એવા વાલીઓનું સન્માન કરવામાં આવ્યું કે જેઓએ પોતાના બાળકોને મજુરી છોડાવી અને ભણવા માટે વિશ્વનીડમનાં હેપ્પીહોમમાં મુક્યા છે.



- 19 નવેમ્બર 2016ના રોજ રાજ્ય કક્ષાએ ચાલતા ખેલ મહાકુંભ અંતર્ગત હેપ્પીહોમના બાળકો દોડમાં તથા અન્ય રમતોમાં પ્રથમ, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ.



- 20 નવેમ્બર 2016નાં રોજ રાજકોટ રેસકોર્ષ ખાતે ફનસ્ટ્રીટમાં વિશ્વનીડમ (હેપ્પીહોમ)નાં બાળકોએ ઉરી સૈનિકોને સલામી આપતું દેશ ભક્તિ ગીત નૃત્ય સાથે રજુ કર્યું.



- 21 નવેમ્બર 2016નાં રોજ નિર્મલા કોન્વેટ સ્કુલ દ્વારા વિશ્વનીડમનાં બાળકો સાથે બાળ અધીકાર દિનની ઉજવણી કરવામાં આવી.



- 22 નવેમ્બર 2016નાં રોજ નિર્મલા સ્કુલમાં વ્યસન મુક્તિ વિશેનો સેમીનાર યોજવામાં આવ્યો જેમાં વિશ્વનીડમના બાળકોએ ભાગ લીધો હતો.

